

દૂધમાં રહેલાં
લેક્ટોજમાંથી મળતાં
ગેલેક્ટો ઓવિઝો
સેકેરાઇડમાંથી
ચોકલેટ જેવી ગમીજું
તૈયાર કરી

ભવિષ્યમાં ખાંડના બદલે GOSનો ઉપયોગ કરી શકશે

દિવસમાં ત૦ આમ ખાંડનો ઉપયોગ હાનિકારક : કૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના

કૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જ્ઞાનાંથી પ્રમાણે દિવસમાં ત૦ આમથી વધુ ખાંડનો ઉપયોગ સ્વાસ્થ માટે હાનિકારક છે. જો કે, એટલી ખાંડ તો સામાન્ય રીતે લોકો ચા-ક્રોમિનાં જ લઈ લેતાં હોય છે. ત્યારે એમ.અ.સ. યુનિવર્સિટીની ફેફલી ઓફ ફેમિલી એન્ડ કાન્ફ્રેન્ચ સાયન્સના કૂડ એન્ડ ન્યૂર્ટ્રિશન વિભાગની રીસર્ચ સ્કોલરે દુધમાં રહેલાં લેક્ટોજમાંથી મળતું અને મોટાં આંતરડાને શુદ્ધ કરતું ફાઈબર GOS શોધ્યું છે. જેને ભવિષ્યમાં ખાંડના સબસ્ટિટ્યુટ તરીકે ઉપયોગમાં લઈ શકાશે.

જે વિશે રીસર્ચ સ્કોલર કેંકોના ડેઅ કહ્યું હતું કે, આ સંશોધન મેં અમારા વિભાગના પ્રો.ડૉ.મીની શેઠના માર્ગદર્શન હેઠળ કહ્યું છે. સામાન્ય રીતે જ્ઞાનાં બાદ લોકોને કંઈક ગળ્યું ખાવાની ટેવ હોય છે. પરંતુ વધુ પડતાં ગળ્યાં પદાર્થ સમય જતાં ગંભીર બિમારીઓ નોંઠરે છે. અમે દુધમાં રહેલાં લેક્ટોજમાંથી મળતાં (કુદરતી જણ્યાપણું) ગેલેક્ટો ઓવિઝો સેકેરાઇડમાંથી ચોકેલેટ જેવી ગમીજું બનાવી છે. જેનાથી ગટ હેલ્થ (મોટું આંતરડું) ઈમ્પ્રુવ થશે અને લોકોને કંઈક ગળ્યું ખાવાનો સંતોષ પણ થશે. ગટ હેલ્થ (મોટું આંતરડું) અને ઝુદ્ય રોગને સીધો સંબંધ છે. તેથી હાલ લોકો પોતાની ગટ હેલ્થને લઈને ખૂબ જ સજીગ બન્યાં છે. પરંતુ તે ત્યારે જ શક્ય છે, જ્યારે તેમાં સારા બેકેટરિયાની સંખ્યા વધુ હોય. અમે જે ગમીજું બનાવી છે, તેનાથી ડાયાબિટિસ, મેન્ટલ હેલ્થ, કબજિયાત વગેરે જેવી સમસ્યાઓથી પણ મહદૂબંશે રાહત મળશે.



૬ મહિના બાદ પણ ગમીજું એવીને એવી જ જોવા મળી !



અમે ગમીજું બનાયાં બાદ તે કેટલાં સમય સુધી સારી રહી શકે છે, તેના પર સ્ટાર્ટી કરી હતી. જેમાં અમે ગમીજુંને ૩૭ ડિગ્રી સેલ્શિયસ તાપમાને રાખી હતી. ત્યારબાદ તેનું ૧ મહિના, ૩ મહિના અને ૬ મહિનાના સમયગાળામાં ટેસ્ટિંગ કર્યું હતું. જેમાં તેનો સ્વાદ કેવો છે, ટેક્સચર કર્યું છે, તેમાં કોઈ પ્રકારના બેકટેરિયા તો નથી વિકસિત થયાં વગેરે તથા કૂડને લગતા દરેક માપદંડોમાંથી ગમીજુંનું ચોકસાઈબર્યુ પરોક્ષાણ કર્યું હતું. જેનાં પરથી અમને જાણાવા મળ્યું હતું કે, ૬ મહિના બાદ ગમીજું સ્વાદમાં, ટેક્સચરમાં એવીને એવી જ જોવા મળી હતી. જેવી ગમીજુંની એકસપાચારી ટેક લાંબા સમય સુધી રહી શકે છે. આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રેસ કોન્ફરન્સમાં અમે રીસર્ચ પેપર પ્રસ્તુત કરીશું.

પ્રો.ડૉ.મીની શેઠ, ચીરાંચ ગાઈડ

ગમીજું ટેસ્ટ કરવા માટે
૧૦ પેનલ મેમ્બર્સને
તૈયાર કરાયા



સૌ પ્રયત્ન અમે માર્કેટમાં મળતી ખાંડમાંથી બનેલી ગમીજુંમાંથી ૫૦% ખાંડ ઓછી કરી રેમાં ૫૦% GOS ઉમેર્યું હતું. ત્યારબાદ તેનું લેવલ વધારી ૧૦૦% GOSના ઉપયોગ સાથે ખાંડ વિનાળી ગમીજું બનાવી હતી. જેને ટેસ્ટ કરવા માટે સ્વાદ પારખવામાં પારંગત ૧૦ લોકોની પેનલને તાલીમ આપી હતી. જેમાં ગમીજુનો કલર, ટેક્સચર, સ્વાદથી લઈ અન્ય દરેક ઓર્ગનોલેટિક માપદંડોમાં તેની ચકાસણી કરાઈ હતી. જેના તારણ સ્વચ્છપે અમને જાણાવા મળ્યું હતું કે, GOSમાંથી બનેલી ગમીજું લાકોને અન્ય ગમીજું જેટલી જ સ્વાદિષ્ટ લાગી હતી. કેંકોના ડે, ચીરાંચ ગાઈડ